

Saurashtra Cement Limited

Corporate Office
N K Mehta International House, 2nd Floor,
178 Backbay Reclamation, Mumbai 400 020
T +91 22 6636 5444
F +91 22 6636 5445
E scl-mum@mehtagroup.com
CIN : L26941GJ1956PLC000840

Ref: B/SCL/SE/SS/206/2025-26

1st August, 2025

BSE Limited, Corporate Relationship Manager , 1st Floor, New Trading Ring, Rotunda Bldg, P.J.Tower, Dalal Street, Mumbai 400001 Stock Code : 502175	National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai – 400051 Stock Symbol : SAURASHCEM
---	--

Sub: Newspaper advertisement of Notice to Shareholders for special window for re-lodgement of transfer requests of physical shares.

Dear Sir/Madam,

Pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 02nd July, 2025, we are enclosing herewith copy of newspaper advertisement of notice to shareholders about the Special Window opened for re-lodgement of transfer requests of physical shares published in Business Standard (English) - All India Edition and Jai Hind (Gujarati) - Rajkot edition dated 1st August, 2025.

Kindly take the same on record and acknowledge.

Thanking you,

Yours faithfully,

For Saurashtra Cement Limited

SONALI Digitally signed
by SONALI
SANAS
LI Date:
2025.08.01
SANAS 15:18:46 +05'30'

Sonali Sanas


Chief Legal Officer, CS & Strategy

Membership No. A16690

Encl.: as above



Regd. Office & Works
Near Railway Station, Ranavav 360 550
Gujarat, India



Cummins India Limited
Regd. Office : Cummins India Office Campus,
Tower A, 5th Floor, Survey No. 21, Balewadi,
Pune 411 045, Maharashtra, India
(CIN: L29112PN1962PLC012276)
Tel.: (020) 67067000 Fax: (020) 67067015
Website: www.cumminsindia.com
Email : ci.investors@cummins.com

PUBLIC NOTICE TO WHOMSOEVER IT MAY CONCERN
This is to inform the General Public that following share certificates of Cummins India Limited, having Registered Office at Cummins India Office Campus, Tower A, 5th Floor, Survey No. 21, Balewadi, Pune 411045, and registered in the name of the following Shareholder(s) have been lost by them.

Folio No.	Name of the Shareholder	Certificate No.	Distinctive Nos.		No. of Shares (F.V. Rs. 2/- each)
			From	To	
K001691	KANTILAL JADAVJI	7803	239526721	239529360	2640

The Public is hereby cautioned/warned against purchasing or dealing in any way with the above referred share certificates. Any person who has any claim in respect of the said share certificate should lodge such claim with the Company within 5 days of publication of this notice after which no claim will be entertained, and the Company shall proceed to issue Duplicate Share Certificates.

For Cummins India Limited
Vinaya A. Joshi
Company Secretary & Compliance Officer

Place: Pune
Date: July 31, 2025



SUNDARAM MUTUAL
— Sundaram Finance Group —

Notice-Cum-Addendum to the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of Schemes of Sundaram Mutual Fund ('Fund')

The unitholders of Sundaram Mutual Fund ("SMF") are requested to take note of following changes:

Change in Nashik Branch address of Sundaram Asset Management Company Limited:

Investors / Unit holders are advised to take note of the change in our branch office address as stated below, which is an official point of acceptance of transactions for the Schemes of Sundaram Mutual Fund:

Existing Address	New Address	Effective Date
Shop No. 1, Shrinath Apartment, Pandit Colony- Lane No. 3, Sharanpur Road, Nashik – 422 002 Telephone: 0253-2311142	Office No. 101, 1st Floor, Roongta Arcade, M. R. Thakkar Road, Opposite Kulkarni Garden, Sharanpur Road, Nashik – 422 002 Telephone: 0253-2311142	04-August-2025

All other terms and conditions of the Scheme Information Document(s) / Key Information Memorandum(s) / Statement of Additional Information will remain unchanged.

This addendum forms an integral part of the Scheme Information Document (SID) / Key Information Memorandum (KIM) / Statement of Additional Information (SAI) of the schemes of Sundaram Mutual Fund as amended from time to time.

Place: Chennai
Date: August 01, 2025.

For more information please contact:
Sundaram Asset Management Company Ltd
(Investment Manager to Sundaram Mutual Fund)
CIN: U93090TN1996PLC034615

Corporate Office: 1st & 2nd Floor, Sundaram Towers, 46, Whites Road, Royapettah, Chennai-14.
Contact No. (India) 1860 425 7237, (NRI) +91 40 2345 2215
www.sundarammutual.com
No. 21, Patullos Road, Chennai 600 002.
Regd. Office:

Mutual Fund Investments are subject to market risks, read all scheme related documents carefully.

SAURASHTRA CEMENT LIMITED
(CIN : L26941GJ1956PLC000840)
Registered Office:
Near Railway Station, Ranavav 360 550, Dist: Porbandar (Gujarat)
E-Mail : sclinvestorquery@mehtagroup.com
Website: https://www.hathi-sidhacements.com/
Regd. Office Phone: 02801-234200, Corporate Office Phone: 022-66365444


SPECIAL WINDOW FOR RE-LODGEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES
In accordance with the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July, 2025, all shareholders are hereby informed that a special window has been opened for re-lodgement of transfer deeds as detailed below:

Tenure for re-lodgement	From: 7 th July, 2025	To: 6 th January, 2026
Who can re-lodge Transfer Requests?	Shareholders whose Transfer Deeds were lodged prior to the deadline of 1 st April, 2019 and rejected/returned/not attended due to deficiency in the documents/process/or otherwise.	
Process for re-lodgement of Transfer Deeds	Shareholders are required to submit original transfer documents, along with corrected or missing information to Company's RTA, MUFG Intime India Pvt. Ltd. (Formerly Link Intime India Pvt. Ltd.). For further details you may contact the RTA of the Company, i.e., MUFG Intime India Pvt. Ltd. (formerly known as M/s. Link Intime India Private Limited) at C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai- 400083, Email - mt.helpdesk@in.mpms.mufg.com / Website: https://in.mpms.mufg.com A copy of the said Circular is also available on the website of the Company at https://scl.mehtagroup.com/investors/share-holder-information	

For Saurashtra Cement Limited

Sonali Sanas
Company Secretary
Membership No. A16690

Place: Mumbai
Date: 31.07.2025




ESTER INDUSTRIES LIMITED
CIN: L24111UR1985PLC015063
Regd. Office: Sohan Nagar, P.O. Charubeta Khatima - 262308, Distt. Udham Singh Nagar, Uttarakhand
Phone: (05943) 250153-57, Fax: (05943) 250158, Website: www.esterindustries.com, Email: investor@ester.in

Extract of Consolidated Financial Results for the quarter ended on 30th June 2025
(Rs. in Crores)

Particulars	Quarter Ended		Year Ended
	30.06.2025	30.06.2024	31.03.2025
Total income	346.85	292.36	1,299.04
EBITDA	28.96	17.39	163.89
Profit Before Tax	(3.81)	(16.66)	27.80
Profit After Tax	(7.16)	(16.10)	13.70
Other Comprehensive Income	(0.45)	(0.04)	(3.61)
Total Comprehensive Income	(7.61)	(16.14)	10.09
Tangible Net Worth	807.13	700.80	772.07

The above is an extract of financial results and is not a statutory advertisement required under applicable SEBI Regulations. The detailed financial results and investor presentation are available on the websites of Stock Exchanges i.e., www.nseindia.com and www.bseindia.com and on the Company's website i.e., www.esterindustries.com.




रेल विकास निगम लिमिटेड
Rail Vikas Nigam Limited
युगवत्ता, रति एवं पारदर्शिता
(A Government of India Enterprise)

RAIL VIKAS NIGAM LIMITED
(A Government of India Enterprise)
Registered office: 1st Floor, August Kranti Bhawan, Bhikaaji Cama Place, R. K. Puram, New Delhi, South Delhi -110066,
CIN: L74999DL2003GO1118633, E-mail: investors@rvnl.org
Website: www.rvnl.org, Phone No.: 011-26738299, Fax: 011-26182957

NOTICE TO THE SHAREHOLDERS FOR 22ND ANNUAL GENERAL MEETING
1. NOTICE is hereby given that the **22nd Annual General Meeting (AGM)** of the members of Rail Vikas Nigam Limited will be held on **Thursday, 28th August, 2025 at 11:30 AM (IST)** through Video Conferencing ("VC") /Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM, being circulated separately. In Compliance with the Ministry of Corporate Affairs (MCA) General Circular No. 09/2024 dated September 19, 2024 and the circular issued earlier in this regard (collectively referred to as 'MCA Circulars') read with SEBI/HO/CFD/GFD-PoD-2/P/CIR/2024/133 dated October 03, 2024 issued by the Securities and Exchange Board of India and in compliance with the provisions of the Act and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI (LODR) Regulations"), the **22nd AGM of the Company** is being held through VC/OAVM.
2. In Compliance with the aforesaid circulars, Notice of the AGM along with the Annual Report 2024-25, will be sent by electronic mode. The aforesaid documents will also be available on the Company's website at www.rvnl.org, the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com, website of CDSL (agency for providing e-voting/remote e-voting facility) i.e. www.evotingindia.com.
3. **Manner of registering /updating email addresses**
a) Members who have not registered their email address are requested to register the same in respect of shares held in electronic form with the depository through their depository participant(s) and in respect of shares held in physical form by writing to the company's Registrar and Share Transfer Agent, Alankit Assignments Limited, 205-208, Anarkali Complex, Jhandewalan Extension, New Delhi- 110055 or by email to virenders@alankit.com.
b) Shareholders who have not registered their email address with the depository participants may procure user id and password in the manner as set out below:
i) In case shares are held in physical mode, please provide Folio No., Name of Shareholder, Scanned Copy of the Share Certificate (Front & Back), PAN (self-attested scanned copy of PAN Card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to virenders@alankit.com.
ii) In case of shares are held in Demat Mode, please provide DP ID & Client ID (16 digit DP ID+Client ID or 16 digit Beneficiary ID), Name, Client Master or copy of Consolidated Account Statement, PAN (self-attested scanned copy of PAN Card) AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to virenders@alankit.com. If you are an individual shareholder holding securities in Demat mode, please refer to the login method explained in the notice of AGM.
c) Alternatively, shareholders /members may send a request to www.evotingindia.com for procuring user ID & password for e-voting by providing the abovementioned documents.
4. **Manner of casting vote(s) through Remote e-voting /e-voting at AGM**
(a) Members will have the opportunity to cast their vote (s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").
(b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of AGM. The details will also be available on the website of Company at www.rvnl.org and on the website of CDSL www.cdslindia.com.
(c) The facility of voting through electronic voting system will also be made available at the AGM and Members attending AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.
(d) The login credentials for casting votes through e-voting shall be made available to all members through email. Members who do not receive email or whose email addresses are not registered with the Company/ Alankit Assignments/ Depository Participants may generate login credentials by following instructions given in the Notes to Notice of AGM.
5. **Manner of registering mandate for receiving dividend**
a) Payment of Dividend shall be made through electronic mode to the shareholders who have updated their bank account details. Dividend warrant/Demand Drafts will be dispatched to the registered address of the shareholders who have not updated their bank account details.
b) For payment of Dividend electronically, members who have not opted for Electronic Clearing System (ECS) facility earlier are requested to fill up ECS mandate form and submit it directly to their depository participants (DP) to avail the ECS facility. Those holding shares in physical form may send the ECS mandate form to Alankit Assignments Limited ("RTA"). The shareholders who hold shares in physical form & who do not wish to opt for ECS facility may please email their bankers' name, branch address & account number to the RTA to enable them to print these details on the dividend warrants.
6. **Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular instructions to register / update e-mail id, for joining AGM, manner of casting votes through remote e-voting or voting at AGM and Dividend related information.**

For Rail Vikas Nigam Limited
Sd/-
Kalpana Dubey
Company Secretary & Compliance Officer

Place : New Delhi
Dated : 31-07-2025



Corporate Identification Number (CIN): L67120RJ1951PLC045966
Registered Office: Jaykaygram, PO – Tyre Factory, Rajsamand, Kankroli – 313 342, Rajasthan, India
Tel: 02952 – 302 400 / 330 011 • **Fax:** 02952 - 232018
Email: kmanik@jkmail.com • **Website:** www.jktyre.com

FORM NO. CAA. 2
[PURSUANT TO SECTION 230(3) OF THE COMPANIES ACT, 2013 AND RULE 6 OF THE COMPANIES (COMPROMISES, ARRANGEMENTS AND AMALGAMATIONS) RULES, 2016]
IN THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, JAIPUR BENCH
INTERLOCUTORY APPLICATION (IA) NO. 27/2025
IN
COMPANY APPLICATION NO. CA(CAA) No. 5/2025
IN THE MATTER OF SECTIONS 230 TO 232 AND OTHER APPLICABLE PROVISIONS OF THE COMPANIES ACT, 2013
AND
IN THE MATTER OF SCHEME OF AMALGAMATION OF CAVENDISH INDUSTRIES LIMITED WITH JK TYRE & INDUSTRIES LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS

JK TYRE & INDUSTRIES LIMITED, a company incorporated under the provisions of Companies Act, 1913 and a company within the meaning of the Companies Act, 2013, having Corporate Identification Number: L67120RJ1951PLC045966 and its registered office at Jaykaygram, PO – Tyre Factory, Rajsamand, Kankroli – 313 342, Rajasthan, India

Company / Transferee Company

Notice and Advertisement of Notice of meetings of equity shareholders and unsecured creditors of the Company

Notice is hereby given that by an Order dated June 12, 2025 read with Order dated July 10, 2025 (uploaded on July 14, 2025) (collectively known as "Tribunal Order"), the Jaipur Bench of the National Company Law Tribunal ("Tribunal") has directed separate meetings of the equity shareholders and unsecured creditors of the Company to be convened and held for the purpose of considering and if thought fit, approving, with or without modification(s), the Scheme of Amalgamation of Cavendish Industries Limited with JK Tyre & Industries Limited and their respective shareholders under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 ("Scheme") and also other applicable Rules and Regulations.

In pursuance of the said Tribunal Order and as directed therein, further notice is hereby given that separate meetings of the equity shareholders and unsecured creditors of the Company will be held as given under:

Sr. No.	Meeting of	Day and Date of Meetings	Time of Meeting (IST)	Mode
1.	Equity Shareholders	Wednesday, September 3, 2025	2.00 p.m.	Through Video Conferencing ("VC") / Other Audio Visual Means
2.	Unsecured Creditors	Wednesday, September 3, 2025	12.30 p.m.	

The equity shareholders and unsecured creditors of the Company are requested to attend their respective meetings through VC / OAVM, as physical attendance at the meetings has been dispensed with. Further, the facility for appointment of proxies will not be available for these meetings. The Scheme if approved by requisite majority by the equity shareholders and unsecured creditors at these meetings will be subject to subsequent approval of the Tribunal and such other approvals, permission, and sanctions of regulatory or other authorities, as may be necessary. Individual notices of the respective meetings which, inter alia, includes the Scheme, Statement under Sections 230 to 232 read with Section 102 and other applicable provisions of the Companies Act, 2013 and Rule 6 of the Companies (Compromise, Arrangement, and Amalgamations) Rules, 2016, and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and also other applicable rules, circulars and guidelines issued by the Securities and Exchange Board of India have been sent: (i) electronically to those equity shareholders whose e-mail addresses are available in the records of the Company / Registrar and Share Transfer Agent / Depository participant(s) / Depositories and the email contains the exact path to access the notice, explanatory statement and other relevant documents; (ii) electronically to those unsecured creditors whose e-mail addresses are available in the records of the Company and the email shall contain the exact path to access the notice, explanatory statement and other relevant documents; and (iii) registered post or speed post or courier to those equity shareholders and unsecured creditors to whose e-mail addresses are not available, a physical letter regarding holding of the meeting have been sent containing a QR code, through which the relevant details – such as the day, date, time, and VC/OAVM login details for the meeting, along with the exact path to access the full notice, explanatory statement and relevant documents along with a copy of the Scheme have been sent in lieu of sending the voluminous physical documents.

The aforesaid notices and accompanying documents are also placed on the: (i) website of the Company and can be accessed at <https://www.jktyre.com/investor/investor-equity-shareholders-notices> (notice of meeting of equity shareholders) and at <https://www.jktyre.com/investor/investor-unsecured-creditors-notices> (notice of meeting of unsecured creditors) ; (ii) website of Central Depository Services (India) Limited ("CDSL") viz. <https://www.evotingindia.com> being the agency appointed by the company to provide remote e-voting, for participation in the Meetings through VC/OAVM and e-voting at the Meeting; and (iii) the website of the Stock Exchanges i.e., BSE Limited ("BSE") viz. www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE") viz. www.nseindia.com.

If so desired, equity shareholders and unsecured creditors may obtain a physical copy of the respective notices and the accompanying documents, free of charge. A written request in this regard, may be addressed to the Company Secretary at kmanik@jkmail.com.

The Hon'ble Tribunal has appointed Justice Vijender Jain, failing whom, Justice M.S. Bedi, to be the Chairperson of the meetings of equity shareholders and unsecured creditors of the Company.

Manner of casting vote(s) through e-voting and attending the meetings through VC/OAVM

The Company is providing to the equity shareholders and unsecured creditors the facility to exercise their right to vote by electronic means, i.e. remote e-voting and e-voting at the meeting (together referred to as "e-voting"). The process and manner of e-voting and attending the meeting through VC/ OAVM is given in the "Notes" section of the notice of the respective meetings. The remote e-voting timelines, and login details for e-voting and attending the meetings are as under:

Particulars	Meetings of Equity Shareholders	Meeting of Unsecured creditors
EVS number of the meeting on CDSL e-voting system	250728001	250728009
Cut-off Date for reckoning entitlement for e-voting and attending the meeting	Wednesday, August 27, 2025	Monday, June 30, 2025
Commencement of remote e-voting	Sunday, August 31, 2025 at 9.00 a.m. (IST)	Sunday, August 31, 2025 at 9.00 a.m. (IST)
Conclusion of remote e-voting	Tuesday, September 2, 2025 at 5.00 p.m. (IST)	Tuesday, September 2, 2025 at 5.00 p.m. (IST)
User ID and Password	Refer Instructions mentioned in the notice of the meeting.	Refer Instructions mentioned in the notice of the meeting.

Note: The remote e-voting facility will be disabled beyond aforesaid date and time.

The equity shareholders and unsecured creditors of the Company will be provided with the facility for e-voting during the respective meetings and those who have not already cast their votes by remote e-voting (prior to meeting) will be eligible to exercise their right to vote at the respective meetings will also be eligible to participate at the respective meetings through VC/OAVM but shall not be entitled to cast their votes again.


A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, i.e., **Wednesday, August 27, 2025 ("Cut-off Date")** only shall be entitled to exercise his/her/its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting of equity shareholders of the Company. A person who is not an Equity Shareholder as on the cut-off date, should treat the Notice for information purposes only. Equity shareholders holding shares in physical form or equity shareholders who have not registered their email addresses may also exercise their voting rights through e-voting and attend the meeting, by following the instructions provided in the notice of the Meeting of Equity Shareholders.

A person whose name is recorded in the list of unsecured creditors available with the Company as on the cut-off date, i.e., **Monday, June 30, 2025 ("Cut-off Date")** only shall be entitled to exercise his / her /its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting of unsecured creditors of the Company. A person who is not an unsecured creditor as on the cut-off date, should treat the Notice for information purpose only. Unsecured creditors whose email addresses are not available in the records of the Company may exercise their voting rights through e-voting and attend the meeting, by following the instructions provided in the notice of the Meeting of Unsecured Creditors.

The Hon'ble Tribunal has appointed Mr. Atul Lakhanpal or failing him, Mr. Sapan Dhir to scrutinize the remote e-voting process as well as e-voting during the respective meetings in a fair and transparent manner and submit the report on the votes cast to the Chairperson of the meetings or to any person so authorized by the Chairperson, within 2 (two) working days of the conclusion of the respective meetings.

The results of e-voting will be declared within 2 (two) working days of the conclusion of the respective meetings and the same, along with the consolidated Scrutinizer's Report, will be placed on the website of the Company: www.jktyre.com and on the website of CDSL at <https://www.evotingindia.com>. The result will simultaneously be communicated to the Stock Exchanges i.e., BSE viz www.bseindia.com and NSE viz. www.nseindia.com. The Company will also display the results on the notice board at the Registered Office and Administrative Office of the Company.

All queries or issues regarding attending Meeting & e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 21 09911.




Place : New Delhi
Date : August 1, 2025

Chairperson appointed for meetings of equity shareholders and unsecured creditors

CIN: L67120RJ1951PLC045966; Website: www.jktyre.com

Sd/-
Justice Vijender Jain
(Former Chief Justice Punjab & Haryana High Court)

Chairperson appointed for meetings of equity shareholders and unsecured creditors



Cummins India Limited
Regd. Office : Cummins India Office Campus,
Tower A, 5th Floor, Survey No. 21, Balewadi,
Pune 411 045, Maharashtra, India
(CIN: L29112PN1962PLC012276)
Tel.: (020) 67067000 Fax: (020) 67067015
Website: www.cumminsindia.com
Email : ci.investors@cummins.com

PUBLIC NOTICE TO WHOMSOEVER IT MAY CONCERN
This is to inform the General Public that following share certificates of Cummins India Limited, having Registered Office at Cummins India Office Campus, Tower A, 5th Floor, Survey No. 21, Balewadi, Pune 411045, and registered in the name of the following Shareholder(s) have been lost by them.

Folio No.	Name of the Shareholder	Certificate No.	Distinctive Nos.	No. of Shares (F.V. Rs. 2/- each)
			From	To
K001691	KANTILAL JADAVJI	7803	239526721	239529360 2640

The Public is hereby cautioned/warned against purchasing or dealing in any way with the above referred share certificates. Any person who has any claim in respect of the said share certificates should lodge such claim with the Company within 5 days of publication of this notice after which no claim will be entertained, and the Company shall proceed to issue Duplicate Share Certificates.

For Cummins India Limited
Vinaya A. Joshi
Company Secretary & Compliance Officer

Place: Pune
Date: July 31, 2025



SUNDARAM MUTUAL
— Sundaram Finance Group —

Notice-Cum-Addendum to the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of Schemes of Sundaram Mutual Fund ('Fund')

The unitholders of Sundaram Mutual Fund ("SMF") are requested to take note of following changes:

Change in Nashik Branch address of Sundaram Asset Management Company Limited:

Investors / Unit holders are advised to take note of the change in our branch office address as stated below, which is an official point of acceptance of transactions for the Schemes of Sundaram Mutual Fund:

Existing Address	New Address	Effective Date
Shop No. 1, Shrinath Apartment, Pandit Colony- Lane No. 3, Sharanpur Road, Nashik – 422 002 Telephone: 0253-2311142	Office No. 101, 1st Floor, Roongta Arcade, M. R. Thakkar Road, Opposite Kulkarni Garden, Sharanpur Road, Nashik – 422 002 Telephone: 0253-2311142	04-August-2025

All other terms and conditions of the Scheme Information Document(s) / Key Information Memorandum(s) / Statement of Additional Information will remain unchanged.

This addendum forms an integral part of the Scheme Information Document (SID) / Key Information Memorandum (KIM) / Statement of Additional Information (SAI) of the schemes of Sundaram Mutual Fund as amended from time to time.

Place: Chennai
Date: August 01, 2025.

For more information please contact:
Sundaram Asset Management Company Ltd
(Investment Manager to Sundaram Mutual Fund)
CIN: U93090TN1996PLC034615

Corporate Office: 1st & 2nd Floor, Sundaram Towers, 46, Whites Road, Royapettah, Chennai-14.
Contact No. (India) 1860 425 7237, (NRI) +91 40 2345 2215
www.sundarammutual.com
No. 21, Patullos Road, Chennai 600 002.
Regd. Office:

Mutual Fund Investments are subject to market risks, read all scheme related documents carefully.

SAURASHTRA CEMENT LIMITED
(CIN : L26941GJ1956PLC00840)
Registered Office:
Near Railway Station, Ranavav 360 550, Dist: Porbandar (Gujarat)
E-Mail : sclinvestorquery@mehtagroup.com
Website: https://www.hathi-sidhacemments.com/
Regd. Office Phone: 02801-234200, Corporate Office Phone: 022-66364444


SPECIAL WINDOW FOR RE-LODGE/MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES
In accordance with the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July, 2025, all shareholders are hereby informed that a special window has been opened for re-lodgement of transfer deeds as detailed below:

Tenure for re-lodgement	From: 7 th July, 2025	To: 6 th January, 2026
Who can re-lodge Transfer Requests?	Shareholders whose Transfer Deeds were lodged prior to the deadline of 1 st April, 2019 and rejected/returned/not attended due to deficiency in the documents/process/or otherwise.	
Process for re-lodgement of Transfer Deeds	Shareholders are required to submit original transfer documents, along with corrected or missing information to Company's RTA, MUFG Intime India Pvt. Ltd. (Formerly Link Intime India Pvt. Ltd.). For further details you may contact the RTA of the Company, i.e., MUFG Intime India Pvt. Ltd. (formerly known as M/s. Link Intime India Private Limited) at C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai- 400083, Email - mt.helpdesk@in.mpms.mufg.com / Website: https://in.mpms.mufg.com A copy of the said Circular is also available on the website of the Company at https://scl.mehtagroup.com/investors/shareholder-information	

For Saurashtra Cement Limited

Sonali Sanas
Company Secretary
Membership No. A16690

Place: Mumbai
Date: 31.07.2025




ESTER INDUSTRIES LIMITED
CIN: L24111UR1985PLC015063
Regd. Office: Sohan Nagar, P.O. Charubeta Khatima - 262308, Distt. Udham Singh Nagar, Uttarakhand
Phone: (05943) 250153-57, Fax: (05943) 250158, Website: www.esterindustries.com, Email: investor@ester.in

Extract of Consolidated Financial Results for the quarter ended on 30th June 2025
(Rs. in Crores)

Particulars	Quarter Ended		Year Ended
	30.06.2025	30.06.2024	31.03.2025
Total income	346.85	292.36	1,299.04
EBITDA	28.96	17.39	163.89
Profit Before Tax	(3.81)	(16.66)	27.80
Profit After Tax	(7.16)	(16.10)	13.70
Other Comprehensive Income	(0.45)	(0.04)	(3.61)
Total Comprehensive Income	(7.61)	(16.14)	10.09
Tangible Net Worth	807.13	700.80	772.07

The above is an extract of financial results and is not a statutory advertisement required under applicable SEBI Regulations. The detailed financial results and investor presentation are available on the websites of Stock Exchanges i.e., www.nseindia.com and www.bseindia.com and on the Company's website i.e., www.esterindustries.com.




रेल विकास निगम लिमिटेड
Rail Vikas Nigam Limited
युगवत्ता, रति एवं पारदर्शिता
(A Government of India Enterprise)

RAIL VIKAS NIGAM LIMITED
(A Government of India Enterprise)
Registered office: 1st Floor, August Kranti Bhawan, Bhikaaji Cama Place, R. K. Puram, New Delhi, South Delhi -110066,
CIN: L74999DL2003GO1118633, E-mail: investors@rvnl.org
Website: www.rvnl.org, Phone No.: 011-26738299, Fax: 011-26182957

NOTICE TO THE SHAREHOLDERS FOR 22ND ANNUAL GENERAL MEETING
1. NOTICE is hereby given that the **22nd Annual General Meeting (AGM)** of the members of Rail Vikas Nigam Limited will be held on **Thursday, 28th August, 2025 at 11:30 AM (IST)** through Video Conferencing ("VC") /Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM, being circulated separately. In Compliance with the Ministry of Corporate Affairs (MCA) General Circular No. 09/2024 dated September 19, 2024 and the circular issued earlier in this regard (collectively referred to as 'MCA Circulars') read with SEBI/HO/CFD/GFD-PoD-2/P/CIR/2024/133 dated October 03, 2024 issued by the Securities and Exchange Board of India and in compliance with the provisions of the Act and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI (LODR) Regulations"), the **22nd AGM of the Company** is being held through VC/OAVM.
2. In Compliance with the aforesaid circulars, Notice of the AGM along with the Annual Report 2024-25, will be sent by electronic mode. The aforesaid documents will also be available on the Company's website at www.rvnl.org, the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com, website of CDSL (agency for providing e-voting/remote e-voting facility) i.e. www.evotingindia.com.
3. **Manner of registering /updating email addresses**
a) Members who have not registered their email address are requested to register the same in respect of shares held in electronic form with the depository through their depository participant(s) and in respect of shares held in physical form by writing to the company's Registrar and Share Transfer Agent, Alankit Assignments Limited, 205-208, Anarkali Complex, Jhandewalan Extension, New Delhi- 110055 or by email to virenders@alankit.com.
b) Shareholders who have not registered their email address with the depository participants may procure user id and password in the manner as set out below:
i) In case shares are held in physical mode, please provide Folio No., Name of Shareholder, Scanned Copy of the Share Certificate (Front & Back), PAN (self-attested scanned copy of PAN Card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to virenders@alankit.com.
ii) In case of shares are held in Demat Mode, please provide DP ID & Client ID (16 digit DP ID+Client ID or 16 digit Beneficiary ID), Name, Client Master or copy of Consolidated Account Statement, PAN (self-attested scanned copy of PAN Card) AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to virenders@alankit.com. If you are an individual shareholder holding securities in Demat mode, please refer to the login method explained in the notice of AGM.
c) Alternatively, shareholders /members may send a request to www.evotingindia.com for procuring user ID & password for e-voting by providing the abovementioned documents.
4. **Manner of casting vote(s) through Remote e-voting /e-voting at AGM**
(a) Members will have the opportunity to cast their vote (s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").
(b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of AGM. The details will also be available on the website of Company at www.rvnl.org and on the website of CDSL www.cdslindia.com.
(c) The facility of voting through electronic voting system will also be made available at the AGM and Members attending AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.
(d) The login credentials for casting votes through e-voting shall be made available to all members through email. Members who do not receive email or whose email addresses are not registered with the Company/ Alankit Assignments/ Depository Participants may generate login credentials by following instructions given in the Notes to Notice of AGM.
5. **Manner of registering mandate for receiving dividend**
a) Payment of Dividend shall be made through electronic mode to the shareholders who have updated their bank account details. Dividend warrant/Demand Drafts will be dispatched to the registered address of the shareholders who have not updated their bank account details.
b) For payment of Dividend electronically, members who have not opted for Electronic Clearing System (ECS) facility earlier are requested to fill up ECS mandate form and submit it directly to their depository participants (DP) to avail the ECS facility. Those holding shares in physical form may send the ECS mandate form to Alankit Assignments Limited ("RTA"). The shareholders who hold shares in physical form & who do not wish to opt for ECS facility may please email their bankers' name, branch address & account number to the RTA to enable them to print these details on the dividend warrants.
6. **Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular instructions to register / update e-mail id, for joining AGM, manner of casting votes through remote e-voting or voting at AGM and Dividend related information.**

For Rail Vikas Nigam Limited
Sd/-
Kalpana Dubey
Company Secretary & Compliance Officer

Place : New Delhi
Dated : 31-07-2025



JK TYRE & INDUSTRIES LTD.
Corporate Identification Number (CIN): L67120RJ1951PLC045966
Registered Office: Jaykaygram, PO – Tyre Factory, Rajsamand, Kankroli – 313 342, Rajasthan, India
Tel: 02952 – 302 400 / 330 011 • Fax: 02952 - 230218
Email: kmanik@jkmail.com • Website: www.jktyre.com


FORM NO. CAA. 2
[PURSUANT TO SECTION 230(3) OF THE COMPANIES ACT, 2013 AND RULE 6 OF THE COMPANIES (COMPROMISES, ARRANGEMENTS AND AMALGAMATIONS) RULES, 2016]
IN THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, JAIPUR BENCH
INTERLOCUTORY APPLICATION (IA) NO. 27/2025
IN
COMPANY APPLICATION NO. CA(CAA) No. 5/2025
IN THE MATTER OF SECTIONS 230 TO 232 AND OTHER APPLICABLE PROVISIONS OF THE COMPANIES ACT, 2013
AND
IN THE MATTER OF SCHEME OF AMALGAMATION OF CAVENDISH INDUSTRIES LIMITED WITH JK TYRE & INDUSTRIES LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS

Sr. No.	Meeting of	Day and Date of Meetings	Time of Meeting (IST)	Mode
1.	Equity Shareholders	Wednesday, September 3, 2025	2.00 p.m.	Through Video Conferencing ("VC") / Other Audio Visual Means
2.	Unsecured Creditors	Wednesday, September 3, 2025	12.30 p.m.	

If so desired, equity shareholders and unsecured creditors may obtain a physical copy of the respective notices and the accompanying documents, free of charge. A written request in this regard, may be addressed to the Company Secretary at kmanik@jkmail.com.
The Hon'ble Tribunal has appointed Justice Vijender Jain, failing whom, Justice M.S. Bedi, to be the Chairperson of the meetings of equity shareholders and unsecured creditors of the Company.
Manner of casting vote(s) through e-voting and attending the meetings through VC/OAVM
The Company is providing to the equity shareholders and unsecured creditors the facility to exercise their right to vote by electronic means, i.e. remote e-voting and e-voting at the meeting (together referred to as "e-voting"). The process and manner of e-voting and attending the meeting through VC/ OAVM is given in the "Notes" section of the notice of the respective meetings. The remote e-voting timelines, and login details for e-voting and attending the meetings are as under:

Particulars	Meetings of Equity Shareholders	Meeting of Unsecured creditors
EVS number of the meeting on CDSL e-voting system	250728001	250728009
Cut-off Date for reckoning entitlement for e-voting and attending the meeting	Wednesday, August 27, 2025	Monday, June 30, 2025
Commencement of remote e-voting	Sunday, August 31, 2025 at 9.00 a.m. (IST)	Sunday, August 31, 2025 at 9.00 a.m. (IST)
Conclusion of remote e-voting	Tuesday, September 2, 2025 at 5.00 p.m. (IST)	Tuesday, September 2, 2025 at 5.00 p.m. (IST)
User ID and Password	Refer Instructions mentioned in the notice of the meeting.	Refer Instructions mentioned in the notice of the meeting.

Note: The remote e-voting facility will be disabled beyond aforesaid date and time.
The equity shareholders and unsecured creditors of the Company will be provided with the facility for e-voting during the respective meetings and those who have not already cast their votes by remote e-voting (prior to meeting) will be eligible to exercise their right to vote at the respective meetings will also be eligible to participate at the respective meetings through VC/OAVM but shall not be entitled to cast their votes again.
A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, i.e., **Wednesday, August 27, 2025 ("Cut-off Date")** only shall be entitled to exercise his/her/its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting of equity shareholders of the Company. A person who is not an Equity Shareholder as on the cut-off date, should treat the Notice for information purposes only. Equity shareholders holding shares in physical form or equity shareholders who have not registered their email addresses may also exercise their voting rights through e-voting and attend the meeting, by following the instructions provided in the notice of the Meeting of Equity Shareholders.
A person whose name is recorded in the list of unsecured creditors available with the Company as on the cut-off date, i.e., **Monday, June 30, 2025 ("Cut-off Date")** only shall be entitled to exercise his / her /its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting of unsecured creditors of the Company. A person who is not an unsecured creditor as on the cut-off date, should treat the Notice for information purpose only. Unsecured creditors whose email addresses are not available in the records of the Company may exercise their voting rights through e-voting and attend the meeting, by following the instructions provided in the notice of the Meeting of Unsecured Creditors.
The Hon'ble Tribunal has appointed Mr. Atul Lakhanpal or failing him, Mr. Sapan Dhir to scrutinize the remote e-voting process as well as e-voting during the respective meetings in a fair and transparent manner and submit the report on the votes cast to the Chairperson of the meetings or to any person so authorized by the Chairperson, within 2 (two) working days of the conclusion of the respective meetings.
The results of e-voting will be declared within 2 (two) working days of the conclusion of the respective meetings and the same, along with the consolidated Scrutinizer's Report, will be placed on the website of the Company: www.jktyre.com and on the website of CDSL at <https://www.evotingindia.com>. The result will simultaneously be communicated to the Stock Exchanges i.e., BSE viz www.bseindia.com and NSE viz. www.nseindia.com. The Company will also display the results on the notice board at the Registered Office and Administrative Office of the Company.
All queries or issues regarding attending Meeting & e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 21 09911.



Place : New Delhi
Date : August 1, 2025

Chairperson appointed for meetings of equity shareholders and unsecured creditors

CIN: L67120RJ1951PLC045966; Website: www.jktyre.com

